

પ્રવચનના મુદ્દા

- ગીતા શાન – વैશ્વિક જીવન જીવવાની પદ્ધતિ
- બહ્લાંડના રહસ્યોની જાણકારી.
- ગીતા શાન એટલે – પ્રકાશ.
- પ્રકાશની પૂજા –

શ્લોક : ઓમ (ॐ) અસતો મા સદ્ગમય।
તમસો મા જ્યોતિર્ગમય।
મૃત્યોર્માર્મતં ગમય ॥
ઓમ (ॐ) શાન્તિ શાન્તિ શાન્તિઃ ॥

(१) कर्मयोग

- (१) अर्जुनविभाष्य योग (२) सांज्च योग (३) कर्म योग (४) ज्ञानकर्मसन्यास योग (५) कर्मसन्यास योग (६) आत्मसंयम योग

(२) भक्तियोग

- (७) ज्ञानविज्ञान योग (८) अक्षरब्रह्म योग (९) राजविघ्नाराराजगुह्य योग (१०) विभूति योग (११) विश्वदृपदर्शन योग (१२) भक्तियोग

(३) ज्ञानयोग

- (१३) क्षेत्रक्षेत्रज्ञ योग (१४) गुणत्रयविभाग योग (१५) पुरुषोत्तम योग (१६) देवासुरसंपद्विभाग योग (१७) श्रद्धात्रयविभाग योग (१८) मोक्षसन्यास योग

- મુંડક ઉપનિષદમાં વિદ્યાના બે પ્રકાર છે.
 - પરા વિદ્યા – અપરા વિદ્યા
- ગીતા એટલે સાર્વત્રીકપણું, મારાપણું નહીં....

**શ્લોક : ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ।
મામકાઃ પાણ્ડવાશ્વૈવ કિમકુર્વત સઞ્ચય॥**

- શ્રી નરેન્દ્રભાઈ મોદી – NEP 2020
- ૩૦-૨૦માં વસુધૈવ કુટુંબકમની ભાવના
- દુનિયામાં યોગ પહોંચ્યો.
- હવે ગીતાના વિચારો પહોંચશે.

- આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ જાપાનના મહારાજાને ગીતાળનું પુસ્તક ભેટ આપતા કહેલું કે, "મારી પાસે અને સમગ્ર વિશ્વની પાસે આપને આપવા માટે ગીતાળથી ઉત્તમ કોઈ ગ્રંથ હોઈ જ ન શકે"
- ભારતીય સંસ્કૃતિમાં સદ્ભાવના

સત્ય
↓

નિર્ભયતા ગાંધીજી

પ્રેમ
↓

ત્યાગ મીરા નરસિંહ મહેતા

કરુણા
↓

અહિંસા—સેવા

સભ્રાટ અશોક — અબ્રાહમ લિંકન — ટોલ્સ ટોય

- આદિ શંકરાચાર્યના ભતે
 - "ભગવદ ગીતાના સ્પષ્ટ જ્ઞાનથી માનવ અસ્તિત્વના તમામ ધ્યેયો સિધ્ય થાય છે. ભગવદ ગીતા એ વૈદિક ગ્રંથોના તમામ ઉપદેશોનો પ્રગટ સાર છે."
 - મહર્ષિ અરવિંદ કહે છે કે,
 - "ભગવદ ગીતા એ માનવજાતનો એક સાચો ગ્રંથ છે. જે પુસ્તકને બદલે જીવંત રચના છે, જેમાં દરેક યુગ માટે નવો સંદેશ અને દરેક સંસ્કૃતિ માટે નવા અર્થ છે.

મહાત્મા ગાંધી કહે છે તે મુજબ,

- "જ્યારે શંકાઓ મને ત્રાસ આપે છે, જ્યારે નિરાશાઓ મને ચહેરા પર જુએ છે અને મને ક્ષિતિજ પર આશાનું એક કિરણ દેખાતું નથી, ત્યારે હું ભગવદ ગીતા તરફ વળું છું અને મને દિલાસો આપવા માટે એક શ્લોક શોધું છું, અને જબરજસ્ત દુઃખની વર્ણે હું તરત જ સ્વિત કરવાનું શરૂ કરું છું. જે લોકો ગીતાનું ધ્યાન કરે છે, તેઓ દરરોજ તેમાંથી નવો આનંદ અને નવા અર્થો મેળવશે."

શ્રી રામકૃષ્ણ કહે છે તે મુજબ,

- "એ જાણીને તે દૈવી જ્ઞાન મેળવો કે જે જાણવાનું બાકી નથી!" આવી વ્યક્તિ માટે જ્ઞાન અને અજ્ઞાનનો એક જ અર્થ છે: શું તમને ભગવાનનું જ્ઞાન છે? જો હા, તો તમે જ્ઞાની! જો નહીં, તો તમે અજ્ઞાની છો. ગીતામાં કહ્યું છે તેમ, અધ્યાય ૧૩/૧૧ આત્મનંશ જ્ઞાન, દરેક જગ્યાએ સાચા જ્ઞાનના પદાર્થ એટલે કે, ભગવાનનું અવલોકન, આ બધું સાચું જ્ઞાન (શાષ્ણપણ) તરીકે જાહેર કરવામાં આવ્યું છે, આની વિરુદ્ધ જે છે તે અજ્ઞાન છે." શ્રીમદ ભગવદ ગીતા માત્ર ભારતનો જ નહીં સમગ્ર વિશ્વનો માર્ગદર્શક ગ્રંથ બની રહ્યો છે. પાશ્ચાત્ય અધ્યેતાઓ શ્રીમદ ભગવદ ગીતા વિશે જણાવે છે તે મુજબ,

આલ્બર્ટ આઈન્સ્ટાઇન (વૈજ્ઞાનિક)

- "જ્યારે હું ભગવદ ગીતા વાંચુ છું અને ભગવાને આ બ્રહ્માંડની રચના કેવી રીતે કરી તેના વિશે ચિંતન કરું છું ત્યારે બાકીનું બધું જ અનાવશ્યક લાગેછે. મેં ભગવદ ગીતાને મારી પ્રેરણા અને માર્ગદર્શકના મુખ્ય સ્ત્રોત તરીકે વૈજ્ઞાનિક તપાસ અને મારા સિધ્યાંતોની રચનાના હેતુ માટે બનાવ્યું છે.

હેનરી ડેવિડ થોરો (અમેરિકન લેખક, કવિ)

- "સવારે હું મારી બુધ્યિને ભગવદ ગીતાની અદ્ભુત અને વૈશ્વિક ફિલસ્ફોઝીમાં સ્નાન કરું છું, જેની સરખામાણીમાં આપણું આધુનિક વિશ્વ અને તેનું સાહિત્ય તુચ્છ અને તુચ્છ લાગે છે.

હર્મન હેન્સ (સાહિત્યમાં નોબંલ પારિતોષિક મેળવનાર)

- ભગવદ ગીતાની અજાયબી એ જીવનની શાશપણનો ખરેખર સુંદર સાક્ષાત્કાર છે. જે તત્ત્વ જ્ઞાનને ધર્મમાં ખીલવા માટે સક્ષમ બનાવે છે.
- કૃષ્ણની વાત : સામાન્ય માણસ વિષયોનું ચિંતન કરે છે.
- તુ જે ચિંતા કરીશ તેવા અવતારને પામીશા
- ચિંતન.....
- સિંમંડ ફોઈડ પણ કહે છે.
- AI^{+3} પર કેથોડનો મારો ચલાવવો.

- ગીતા ચિંતક બનાવે છે, એકવાર તત્વજ્ઞાન સ્પર્શી ગયું તો આપો આપ જ્ઞાનની સરવાણી વહ્યા કરે.
- કીટ ભ્રમર ન્યાય
- કર્મ કર – ફળની આશા ન રાખ
 - કર્મ કર તેવું જ ફળ પ્રાપ્ત
 - ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ
 - કર્મનો પદ્ધો – પીપળાની કુપળ
 - કર્મ નષ્ટ થતો નથી.
 - ઉજ્જી નષ્ટ થતી નથી : $E = MC^2$

શ્લોક : કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।
 મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ॥

- गीतामां यज्ञना प्रकार
श्लोक : यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
 भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥
- तमे गमे तेवुं कार्य करो तो पण दंभी लोको – असूरी वृत्ति बतावशे –
 शीशुपाल – वृत्ति
श्लोक : दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
 अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ॥
- तु कर्म करीने निमित्त बन.
- अधु ४ मारा चरणोभां धरी दे – GST, 370, सर्जकल स्ट्राईक
श्लोक : यत्करोषि यदश्नासि यजुहोषि ददासि यत् ।
 यत्पस्यसि कौन्तेय तत्कुरुष्व मर्दर्पणम् ॥

- યુવાન તુ યોગક્ષેમની ચિંતા ન કર
શ્લોક : અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ् ॥
- ઈચ્છા – તૃપ્તિ વચ્ચેનો ભેદ
- જીત – મનની સાચી છે.
- જ્યાં જવાનું છે, ત્યાં લઈ જશે.
- પરાક્રમ વૃત્તિ – જુકેગા નહીં
- નિર્ભયતા
- નિષ્ઠાવાન
- સ્થિત પ્રક્ષતા

- ગીતા સંસારીઓ માટે છે – પૂ.દાદા
- સન્યાસી – યોગી કોણાં..

શ્લોક : અનાશ્રિતઃ કર્મફળં કાર્ય કરોતિ યઃ।

સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ॥

- પુરું બ્રહ્માંડ ગતિશીલ છે – સત્ય છે, કર્મ પણ સત્ય છે. – સરદાર સાહેબ
- બધુ જ પરિવર્તનશીલ છે, તું નિભિત માત્ર છે.
- તેજસ્વીતાનું પુજન – સ્વામી વિવેકાનંદ – નચિકેતા

- सुख प्राप्ति भाटे शुं करवुं? – अपमान–मान–भित्र–वेरी–सुख हुःख
 श्लोक : मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः।
 सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते॥
- प्रदृष्टाणना प्रकार
- ज्ञवन स्वर्च्छा भाटे
- गीता ने पर्यावरण
- दिव्य ज्ञवननी पध्धति
- हृदयनी शुद्धता केवी रीते?
 ○ आंतरिक संस्कारे

श्लोक : कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
 इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥

- શિક્ષણ સાધારણ નહીં હોતા હૈ
પ્રબળ – નિર્માણ તેની ગોટમાં હોય છે.
- ગુજરાતના હે મારા ગુરુજનો... આપનું કર્મ શ્રેષ્ઠ છે.

**શ્લોક : તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા।
ઉપદેશ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ॥**

- આશક્તિ / અનાશક્તિ વૂત્તિ
- બ્રહ્મ સત્ય – જગત ભિથ્યા શંકરાચાર્યજી

- ગીતાના સંદેશ સાથે

સાઉથમાં : (૧) તિરુવલ્લુવર (૨) નાંબિ (૩) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણાન
(૪) કુમારિલ ભણ (૫) રામાનુજાચાર્ય

મહારાષ્ટ્ર : વીર સાવરકર, જ્યોતિબા ફુલે, છત્રપતિ શિવાજી, અગસ્ત
ઋષિ

ગુજરાત : કૃષ્ણા, સ્વામિનારાયણ ભગવાન, વૈષ્ણવ સંપ્રદાયની બેઠક,
સોમનાથ જ્યોતિર્લિંગ, સ્વામિ આત્માનંદ સરસ્વતિ, શ્યામજી
કૃષ્ણ વર્મા, ગાંધી, સરદાર સાહેબ, ઉમાશંકર જોષી,
કૃષ્ણકુમારસિંહજી,
નરસિંહ મહેતાનું – વૈષ્ણવ જન તો.

વेस्ट बंगाल : स्वामि विवेकानन्द, रामकृष्ण परमहंस, डॉ. श्यामाप्रसाद
मुखर्जी, रविन्द्रनाथ टेगोर

उत्तरभाँ : हर्ष – खंडन खंड खाद्य ग्रंथ

મध्यभाँ : संत तुकाराम, कृष्ण, राम, अकलव्य, गुरु गोविंदसिंह,
ज्येष्ठेवनुं गीत गोविंदम, गुणाध्यनुं गान

- भ्रह्म सत्य – जगत मिथ्या शंकराचार्यज्ञ

अध्याय-५ : कर्म सन्यास योग :

- कर्त्तृपश्चानो त्याग, शतेन्द्रीय कर्मयोगीना लक्षणो

अध्याय-६ : आत्म संयम योग :

- मन नियंत्रण अने विचलन (६.५ – ६.१०)
- तैयारी करवानी पद्धति (६.११ – ६.१२)
- ध्याननी प्रक्रिया (६.१३ – ६.१४)
- योग प्रक्रियामां संपूर्णता (६.१८ – ६.२८)
- असङ्ग योगीनुं गंतव्य (६.३७ – ६.४६)
- कर्म सन्यास करतां कर्म योग श्रेष्ठ

अध्याय-७ : ज्ञान विज्ञान योग :

- परा प्रकृति – अपरा प्रकृति, निष्काम योग, सर्वग्राही अभिगम, स्व संकल्पना।

अध्याय-८ : अक्षर ब्रह्म योग :

- कृष्ण ब्रह्म, आत्मा अने कर्मनी चोकक्स व्याख्याओ साथे अध्यायनी शब्दआत करे छે. स्वज्ञान.. मुक्ति तरफनी गति परम तत्व, आत्मा अने स्वत्वनी समज.

અધ્યાય-૮ : રાજ વિદ્યારાજગુહ્ય યોગ :

- વિજ્ઞાન સહિતનું જ્ઞાન એ શિક્ષણનો રાજા છે, જે જીવનના તમામ રહસ્યોમાં સૌથી વધુ ગુઢ છે. તે સૌથી શુદ્ધ જ્ઞાન છે, તે સાક્ષાત્કાર દ્વારા સ્વની પ્રત્યક્ષ સમજ આપે છે, તે ધર્મની સંપૂર્ણતા છે. તે શાશ્વત છે, અને તે આનંદપૂર્વક પ્રાયોજવામાં આવે છે. નિષ્કામભાવે કરેલું કર્મ **યોગ ક્ષેમં વહામ્યહમ..**

અધ્યાય ૧૦ : વિભૂતિ યોગઃ

- ભક્તિની ભૂખ, જિજ્ઞાસાની ચરમસીમાએ પહોંચી જ્ઞાન પ્રાપ્તિ શક્ય..
અખિલ બ્રહ્માંડમા એક તુ શ્રી હરિ.... અહુમ બ્રહ્માસ્તિમ....શુદ્ધિ.. થી
વિશુદ્ધિ...

અધ્યાય ૧૧ : વિશ્વરૂપ દર્શન યોગઃ

- ભમિત મન પોતાની મેળે ભમણામાંથી બહાર આવી શકતું નથી, તે ગુરુ
કૃપાથી જ થઈ શકે છે; તેને માર્ગ દર્શક-પથ દર્શકની જરૂર છે. જે વ્યક્તિ
પાણીમાં ડૂબી રહ્યો છે, તે પાણીમાંથી કૂદી શકતો નથી કારણ કે તે ડૂબી
રહ્યો છે. જો તે તરી શકતો હોત, તો તે તર્યો હોત. Learning by
doing... પ્રક્રિયા માંથી પસાર થઈ પ્રાપ્ત થયેલું જ્ઞાન ચિરસ્થાયી બને છે..

અધ્યાય ૧૨ : ભક્તિ ચોગઃ

- આ અધ્યાય વ્યક્તિમા 39 ગુણ સૂચવે છે જેમાંથી એક પણ ગુણ જીવનભર કેળવી શક્યા તો જીવન ઉત્સવ બની રહે... સત્ય, નિષ્કામ પ્રેમ, કરુણા , સ્થિર બુદ્ધિ, સમતા , શ્રદ્ધા, કર્મ ફળ ત્યાગ.... ત્યાગી ને ભોગવી જાણો ...

અધ્યાય ૧૪ : ગુણત્રચિલ્પિભાગ ચોગ :

- આ પ્રકરણમાં, ભૌતિક ઊર્જાનો સ્વભાવ સમજાવે છે, જે શારીર અને તેના તત્ત્વોનો સ્ત્રોત છે. આમ, તે મન અને દ્રવ્ય બંનેની ઉત્પત્તિ છે. ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણો (પદ્ધતિઓ) થી બનેલી છે – સત્ત્વ (સારાપણું), રજસ (ઉત્સાહ) અને તમસ (અજ્ઞાન)

અધ્યાય ૧૫ : પુરુષોત્તમ યોગ :

- ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ... નાશવંત.. અવિનાશી અને પરમ તત્ત્વની સમજ ભૌતિકવાદ થી પાર અધ્યાત્મવાદ સુધી નો સ્વ વિસ્તાર

અધ્યાય ૧૬ : દૈવાસ્તુરસંપન્ડિતભાગ યોગ :

- પરમ દિવ્યપુરુષે કહું: હે ભારતવંશી, આ દિવ્ય રવભાવથી સંપત્ત લોકોના પવિત્ર ગુણો છે – નિર્ભયતા, મનની શુદ્ધતા, આદ્યાત્મિક જ્ઞાનમાં અડગતા, દાન, ઈન્દ્રિયો પર નિયંત્રણ, ત્યાગ, પવિત્ર પુસ્તકોનો અભ્યાસ, તપસ્યા, સરળતા, અહિંસા, કર્તવ્ય અને કર્તવ્યની સમજ કામ, કોઘ, લોભ, ત્યાગી કલ્યાણ માર્ગે આગળ વધયું

અધ્યાય ૧૭ શ્રીદ્વાત્રચિભાગ યોગ :

- સત્ત્વ રજસ અને તમસ પ્રકૃતિની આહાર વિહાર વિચાર પર અસર...
કર્મચારી એજ કર્તવ્ય... મનનો નિગ્રહ મનની પ્રસંગતા અને અંતઃકરણાના
ભાવોની પવિત્રતા એ મનનું તપ...
ॐ તત્ સત...સત ચિત આનંદ...

અધ્યાય ૧૮ મોક્ષસન્યાસ યોગ :

- જ્ઞાતા જ્ઞાન અને જ્ઞોય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરક...કર્તા...કરણ...
કિયા...ત્રણ પ્રકારના કર્મ સાધનોની સમજ... પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ
માર્ગ...પરમ તત્ત્વને અનુભવી અજ્ઞાન માંથી ઉપજેલ મોહને ત્યાગી કર્મ કરે
જવું ફળની ચિંતા ન કરવી...